

B.Com. Semester - 3 (CBCS) Examination
July-2025 (OLD COURSE)
CORPORATE ACCOUNTING - 1(CORE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ તા. 31.03.2025 ના રોજ પૂરા થતાં વર્ષનું ભીમ લી. નું કાર્યું સરવૈયું નીચે મુજબ છે;

(૨૦)

વિગત	રકમ રૂ.	રકમ રૂ.
શરૂનો સ્ટોક	75000	-
ખરીદ પરત	-	10000
ખરીદ વેચાણ	245000	340000
મજૂરી	30000	-
વટાવ	-	3000
આવક ગાડાભાડુ	950	-
ફર્નિચર	17000	-
પગાર	7500	-
ભાડુ	4000	-
પરચૂરણ ખર્ચ	7050	-
નફા નુકસાન ખાતું (1-4-2024)	-	15000
ડિવિડન્ડ (ગઈ સાલનું)	9000	-
શેર થાપણ	-	100000
દેવાદારો - લેણદારો	27500	17500
પ્લાન્ટ યંત્રો	29000	-
રોકડ	46200	-
સામાન્ય અનામત	-	15500
પેટન્ટસ	4800	-
ફૂંડીઓ	5000	7000
	508000	508000

વધારાની માહિતી;

- (1) આખર સ્ટોક ની કિંમત રૂ. 88000 ગણવી.
- (2) 50% ના દરે ઇન્કમ ટેક્સની જોગવાઈ કરો.
- (3) પ્લાન્ટ યંત્રો પર 15%, ફર્નિચર પર 10% અને પેટન્ટ પર 5% ઘસારો ગણો.
- (4) ચુકવવાના બાકી ખર્ચ : ભાડુ રૂ. 800 અને પગાર રૂ. 900
- (5) બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા 15% ડિવિડન્ડ ની ભલામણ કરવામાં આવી ચે.
- (6) કરવેરા બાદના નફાના 5% સામાન્ય અનામત ખાતે લઈ જાઓ.
- (7) રૂ. 510 ઘાલખાધ પડી છે તેની જોગવાઈ કરો.
- (8) કરવેરા પહેલાના નફાના 10% સંચાલકીય મહેનતાણું આપવાનું છે.

ઉપરની વિગતો પરથી ભીમ લી. નું 31.03.2025 ના રોજનું કંપની ધારા 2013 મુજબનું પાકું સરવૈયું અને તે તારીખના પાકું સરવૈયું તેમજ તે રોજ પૂરા થતાં વર્ષનું નફા નુકસાન ખાતું તૈયાર કરો. (અન્ય નોંધ ફરજિયાત નથી)

પ્રશ્ન-૧ નીચેની વિગતો પરથી અર્જુન લી. નું તારીખ 31.03.2025 ના રોજનું કંપની ધારા 2013 મુજબનું પાકું (૨૦) સરવૈયું અને તે તારીખના રોજ પૂરા થતાં વર્ષનું નફા નુકસાન ખાતું તૈયાર કરો. (નોંધ ફરજિયાત નથી)

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
જમીન મકાન	580000	ઇક્વિટી શેરમૂડી	1000000
સંચા યંત્રો	450000	વેચાણ	2800000
શરૂનો સ્ટોક	260000	12% ના ડિબેન્ચર	600000
મોટર વાહનો	140000	(તા. 31-3-34 ના રોજ પરત કરવાના)	
ફર્નિચર	80000	12%ની ડિરેક્ટરની લોન (1-7-24 થી)	60000
ટેલિફોન ડિપોઝિટ	12000	ખરીદ પરત	40000
અગાઉથી ચૂકવેલ આવકવેરો	80000	લેણદારો	118000
ડિબેન્ચર વ્યાજ	36000	સ્ટાફ પ્રો. ફંડ	90000
વેચાણ પરત	50000	શેર જપ્તી ખાતું	6000
ડિબેન્ચર વટાવ	30000	10%ની ફિક્સ ડિપોઝિટ (31-3-2025)	79000
ખરીદી	2050000	સામાન્ય અનામત	70000
પગાર (25-2-25 સુધી)	132000	ન. નું. ખાતું (1-4-2024)	55000
મજૂરી	69000	ડિવિડન્ડ સમતુલા ફંડ	24000
જકાત	5000	દેવી હૂંડી	20100
આવકમાલ ગાડાભાડુ	59000	શેર પ્રીમિયમ	60000
ડિરેક્ટરોનું મહેનતાણું	52000	ડિવિડન્ડ (ગ્રોસ રૂ. 12000)	9600
રાધા ક્રિષ્ન લી. ના 3000			
-ઇ. શેર દરેક રૂ. 100 નો			
-રૂ. 80 ભરપાઈ	240000		
છૂટા ઓજારો	18000		
લેણી હૂંડી	36600		
બાહેંધરી કમિશન	15000		
દેવાદારો	260000		
રોકડ સિલક	45500		
સ્ટેટ બેન્કનું ચાલુ ખાતું	149500		
સ્ટેશનરી છપામણી	18000		
વાહન રિપેરિંગ	21000		
લીગલ ખર્ચ	15000		
લવાજમ	4100		
મુસાફરી ખર્ચ	18000		
પોસ્ટેજ તાર ટપાલ	16000		
ભાડું વેરા વીમો	36000		
સ્ટોર્સ - સ્પેર્સ	30000		
જાહેરાત	24000		

નીચે આપેલ વધારાવધારાની માહિતી ધ્યાનમાં લઈ કંપની ધારા અન્વયે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરો.

- (1) આખર સ્ટોકની કિંમત રૂ. 4,34,000 છે જે પૈકી રૂ. 6,000 નો માલ નુકસાનીવાળો છે જેની બજાર કિંમત શૂન્ય ગણવી.
- (2) સાંચા-ચંત્રો ઉપર 10%, જમીન મકાન પર 2.5% અને મોટરવાહનો તથા ફર્નિચર ઉપર 15% ઘસારો ગણવો.
- (3) રૂ. 60,000 ના દેવાદારો છ માસથી વધુ મુદતના છે. દેવાદારોના 5% ધાલખાધ અનામતની જોગવાઈ કરો.
- (4) બાંયધરી કમિશનની 1/3 રકમ માંડી વાળો.
- (5) ચાલુ વર્ષના ચોખ્ખા નફાના 40% લેખે કરવેરાની જોગવાઈ કરવી.
- (6) રૂ. 25,000 સામાન્ય અનામત ખાતે લઈ, ઇક્વિટી મૂડી ઉપર 7.5% લેખે ડિવિડન્ડની ડિરેક્ટરોએ ભલામણ કરેલ છે.

પ્રશ્ન-૨ ગાંધારી લી. નું તા. 31.03.2025 ના રોજનું સરવૈયું નીચે મુજબ છે;

(૨૦)

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
4000 ઇક્વિટી શેર દરેક રૂ. 100	400000	જમીન	100000
9%ના રિડિમેબલ પ્રેફરન્સ શેર દરેક રૂ. 100		મકાન	283000
ના 80 ભરપાઈ	160000	સાંચા-ચંત્રો	255000
8%ના રિડિમેબલ પ્રેફરન્સ શેર દરેક રૂ. 100નો		રોકાણો	190000
પૂરો ભરપાઈ	300000	સ્ટોક	200000
10%ના ઈરીડીયેબલ પ્રેફ. શેર દરેક રૂ. 100નો		દેવાદારો	190000
પૂરા ભરપાઈ	100000	બેંક સિલક	82000
શેર પ્રીમિયમ	10000		
સામાન્ય અનામત	110000		
ન.નું. ખાતું	140000		
લેણદારો	80000		
	1300000		1300000

આ તારીખે કંપનીએ પ્રેફરન્સ શેરોને 10% પ્રીમિયમ પરત કરવાનું નક્કી કર્યું. આ હેતુ માટે જરૂરી સંખ્યામાં ઇક્વિટી શેરો દરેક રૂ. 100નો 20% પ્રીમિયમ બહાર પાડ્યા.

ધંધામાં બેંક સિલક રૂ. 88,000 રાખવાની છે. બધાં જ રોકાણો રૂ. 1,80,000 માં વેંચ્યા.

પ્રેફ. શેરહોલ્ડરોને પૂરા નાણાં ચૂકવી દેવામાં આવ્યા. કંપનીના ચોપડામાં મૂડી પરત બાદનું કંપની ધારા-2013 મુજબનું ઊભું પાકું સરવૈયું તૈયાર કરો. જરૂરી ગણતરી દર્શાવો.

અથવા

પ્રશ્ન-૨ ઉપરના પ્રશ્ન પરથી ગાંધારી લી. ના ચોપડે જરૂરી ગણતરી કરી આમનોંધ લખો.

(૨૦)

પ્રશ્ન-૩ ભીષ્મ લી. નું તા. 31.03.2025 ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે;

(૧૫)

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
ઈક્વિટી શેર દરેક રૂ. 100નો તેવા	200000	મકાન	162500
પ્રેફરન્સ શેર રૂ. 10નો તેવા	50000	ફ્રેન્ચાઈઝી	12500
10% ડિબેન્ચર્સ	50000	મશીનરી	62500
પ્રોવિડન્ટ ફંડ	50000	ટેક. શોધ-ખોળ	12500

લેણદારો	50000	સ્ટોક	62500
લેણીફુંડીઓ	3000	દેવાદારો	10000
		નફા-નુકસાન ખાતું	95000
		જાહેરાત ઝુંબેશ	12500
	430000		430000

નીચે મુજબની મુડીઘટાડાની યોજના કોર્ટ દ્વારા મંજૂર થઈ.

- (1) ઇક્વિટી શેરમૂડી શેરદીઠ રૂ. 5 થી ઘટાડવી
- (2) પ્રેફરન્સ શેરમૂડી રૂ. 25,000 સુધી રદ કરવી
- (3) ડિબેન્ચર હોલ્ડર્સ તેઓનું દેવું રૂ. 25,000 થી જતું કરવા તૈયાર થયા છે.
- (4) લેણદારો રૂ. 25,000 જતા કરવા તૈયાર છે.
- (5) સ્થિર મિલકતો 90% થી પુનઃઆકારણી કરવી
- (6) બધીજ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી.

કંપનીના ચોપડે મૂડી ઘટાડા ખાતું તૈયાર કરો અને જરૂરી આમનોંધ લખો.

અથવા

પ્રશ્ન-૩ ઉપર આપેલ પ્રશ્ન પરથી ભીષ્મ લી. નું. મૂડી ઘટાડા બાદનું કંપની ધારા 2013 મુજબનું પાકું સરવૈયું તૈયાર કરો. (૧૫)

પ્રશ્ન-૪ કર્ણા લી. એ રૂ. 10 નો એક એવા 90000 ઇ. શેર બહાર પાડ્યા છે. આ અંગે ત્રણ દલાલોએ નીચે મુજબ (૧૫)
બાહેંધરી લીધેલ છે. દલાલોને 4% કમિશન આપવાનું છે.

પરેશ 45,000 શેર, પરાગ 30,000 શેર, પ્રવિણ 15,000 શેર.

આ ઉપરાંત ત્રણેએ નીચે મુજબ નિશ્ચિત બાંધધરી માટે અરજી કરી છે:

પરેશ 7,500 શેર, પરાગ 4,500 શેર, પ્રવિણ 4,500 શેર.

કંપનીને નિશ્ચિત બાંધધરી સિવાય 60,000 શેર માટે અરજી મળી છે, જે પૈકી નિશાનીવાળી અરજીઓ 45,000 શેર માટેની હતી, જે નીચે પ્રમાણે હતી:

પરેશ 18,000 શેર, પરાગ 15,000 શેર, પ્રવિણ 12,000 શેર.

દરેક બાંધધરી દલાલની જવાબદારી નક્કી કરો. નિશ્ચિત બાંધધરી અંગે કોઈ રકમ જમા આપવામાં આવતી નથી.

દલાલો પાસેથી વસૂલ કરવાની અથવા આપવાની ચોખ્ખી રકમ શોધો.

અથવા

પ્રશ્ન-૪ ઉપરના પ્રશ્ન માટે કર્ણા લી. ના ચોપડે જરૂરી આમનોંધ લખો. (૧૫)

ENGLISH VERSION

Que-1 Balance sheet of Bhim Ltd. for the year ending 31.03.2025 is as under; (20)

Particulars	Amount Rs.	Amount Rs.
Opening stock	75000	-
Purchase return	-	10000
Purchases and sales	245000	340000
Wages	30000	-
Discount	-	3000
Carriage inward	950	-
Furniture	17000	-
Salary	7500	-
Rent	4000	-
Sundry expenses	7050	-
Profit and loss account (1-4-24)	-	15000
Dividend (previous year)	9000	-
Share capital	-	100000

Debtors and creditors	27500	17500
Plant and machinery	29000	-
Cash	46200	-
General reserve	-	15500
Patents	4800	-
Bills	5000	7000
	508000	508000

Prepare balance sheet as on 31.03.2025 and profit and loss account for the year ending that date as per companies act 2013 on the basis of following information; (preparing other notes is not compulsory)

- (1) Closing stock is values at Rs. 88000.
- (2) Provide 50% for income tax.
- (3) Write off 15 % on plant and machinery, 10% on furniture and 5% on patents.
- (4) Unpaid expenses: Rent Rs. 800 and salary Rs. 900
- (5) Board of directors recommended 15% dividend on equity capital.
- (6) Provide 5% of profit after tax for general reserve.
- (7) Provide for bad debt Rs. 510.
- (8) Managerial remuneration at 10% of profit before tax is to be paid.

OR

Que-1 Prepare balance sheet of Arjun Ltd. as on 31.03.2025 and profit and loss account for the year ending that date as per companies act 2013 on the basis of following information; (preparing other notes is not compulsory) (20)

Particulars	Amount Rs.	Particulars	Amount Rs.
Land and buildings	580000	Equity share capital	1000000
Plant and machinery	450000	Sales	2800000
Opening stock	260000	12% debentures	600000
Motor vehicles	140000	(Redeemable on 31-03-34)	
Furniture	80000	12% director's loan (from 1-7-24)	60000
Telephone deposit	12000	Purchase return	40000
Advance income tax	80000	Creditors	118000
Debenture interest	36000	Staff provident fund	90000
Sales return	50000	Sher forfeiture	6000
Debenture discount	30000	10% fixed deposit (31-3-2025)	79000
Purchases	2050000	General reserve	70000
Salary (till 25-02-25)	132000	Profit and loss a/c.(1-4-2024)	55000
Wages	69000	Dividend equalization fund	24000
Octroi	5000	Bills payable	20100
Carriage inward	59000	Share premium	60000
Director's remuneration	52000	Dividend (gross Rs. 12000)	9600
Shares of Radha krishna Ltd. (3000 shares of Rs. 100 each, Rs. 80 paid up)	240000		
Loose tools	18000		
Bills receivable	36600		
Underwriting commission	15000		
Debtors	260000		
Cash on hand	45500		
State bank of India current a/c	149500		
Stationery and printing	18000		
Vehicle repairing	21000		
Legal expenses	15000		
Subscription	4100		
Travelling expenses	18000		
Postage and telegram	16000		
Rent and taxes	36000		
Stores and spares	30000		
Advertisement expenses	24000		

Prepare final accounts from the details given below;

- (1) Value of closing stock is Rs. 434000 in which goods worth Rs. 6000 is damaged and has no market value.
- (2) Provide depreciation at 10% on plant machinery, 2.5% on land and buildings and 15% on motor vehicles and furniture.
- (3) Debtors of Rs. 60000 are for more than six months. Provide 5% for bad debt reserve.
- (4) Write off 1/5 amount of underwriting commission.
- (5) Provide 40% for taxation from the profit of current year.
- (6) Transfer Rs. 25000 to general reserve after providing for 7.5% dividend on equity capital.

Que-2 Following is the balance sheet of Gandhari Ltd. as on 31.03.2025; (20)

Liabilities	Amount Rs.	Assets	Amount Rs.
4000 equity shares of Rs. 100 each	400000	Land	100000
9% redeemable preference shares of Rs. 100 each, Rs. 80 paid up	160000	Building	283000
8% redeemable preference shares of Rs. 100 each, fully paid up	300000	Machinery	255000
10% irredeemable preference shares of Rs. 100 each, fully paid up	100000	Investments	190000
Share premium	10000	Stock	200000
General reserve	110000	Debtors	190000
Profit and loss account	140000	Bank	82000
Creditors	80000		
	1300000		1300000

Company decided to redeem preference shares at 10% premium on this date. For this purpose, necessary number of equity shares of Rs. 100 each were issued at 20% premium. Bank balance of Rs. 88000 is to be maintained in the business. All investments were sold off at Rs. 180000. Preference shareholders were paid in full.

Show necessary calculations and prepare balance sheet as per companies act 2013 after redemption of preference shares.

OR

Que-2 Prepare journal entries in the books of Gandhari Ltd. and show necessary calculation on the basis of the above question. (20)

Que-3 Following is the balance sheet of Bhishm Ltd. as on 31.03.2025. (15)

Liabilities	Amount Rs.	Assets	Amount Rs.
Equity shares of Rs. 100 each	200000	Building	162500
Preference shares of 10 each	50000	Franchise	12500
10% debentures	50000	Machinery	62500
Provident fund	50000	Technical research	12500
Creditors	50000	Stock	62500
Bills payable	30000	Debtors	10000
		Profit and loss ac	95000
		Advertisement campaign	12500
	430000		430000

Court has sanctioned capital reduction scheme as under;

- (1) To reduce equity shares by Rs. 5 per share.
- (2) To write off preference share capital upto Rs. 25000.
- (3) Debenture holders agreed to give away their dues of Rs. 25000.
- (4) Creditors are ready to give up Rs. 25000.
- (5) Fixed assets are to be revalued to 90%.
- (6) Write off all intangible and fictitious assets.

Write necessary journal entries and Prepare Capital Reduction Account in the books of the company.

OR

Que-3 On the basis of the question given above, prepare balance sheet of Bhishm Ltd. as per company's act 2013 after capital reduction. (15)

- Que-4 Karn Ltd. issued 90000 equity shares of Rs. 10 each. Three underwriters have taken (15)
responsibility as under. They are to be paid 4% commission.
Paresh 45000 shares, Parag 30000 shares and Pravin 15000 shares
They also took firm underwriting as under;
Paresh 7500 shares, Parag 4500 shares and Pravin 4500 shares
Company received applications for 60000 shares excluding firm underwriting in which
marked applications are for 45000 shares divided as under;
Paresh 18000 shares, Parag 15000 shares and Pravin 12000 shares
Calculate net responsibility of each underwriter. Credit of firm underwriting is not given.
Find out amount to be collected from or paid to the underwriters.

OR

- Que-4 Write necessary journal entries in the books of Karn Ltd. from the above question. (15)
